

IIT દ્વારા શિક્ષકોની ગણિત-વિજ્ઞાન વર્કશોપ

અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ૧૦૦થી વધુ શિક્ષકો ૫ અને ૬ ફેબ્રુઆરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી-ગાંધીનગર દ્વારા આયોજિત ગણિત અને વિજ્ઞાનના વર્કશોપમાં ભાગ લેશે. આ વર્કશોપમાં શિક્ષકોને રોજીંદી વસ્તુઓના ઉપયોગ તેમજ રમકડાઓથી ગણિત અને વિજ્ઞાનના જટીલ પ્રયોગો અને સિદ્ધાંતો શીખવવામાં આવશે.